



જનસંપર્ક અધીકારી દ્વારા

પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર

ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૧૭/૦૬/૨૦૧૯ સોમવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૦૩૦/૧૯

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૬૮ કેસ કરી, ૫૬ વ્યક્તિઓને ઝડપી, ૩૦૯ લીટર દેશી દારૂ, ૫૮૭ બોટલ ઈંગ્લીશ દારૂ અને ૩ સ્ફૂટર કબજે કર્યા હતા. તેમજ જુગાર ધારા હેઠળ ૮ કેસ કરી ૪૩ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૧,૮૨,૮૬૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૦૩૧/૧૯

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૧૦ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી ૯૩ મુજબ ૧ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

છેતરપીંડીની ફરીયાદ:-

સમાચાર યાદી નં.૧૦૩૨/૧૯

સાબરમતી : જિજ્ઞેશભાઈ જનકભાઈ મહેતા (ઉ.વ.૪૬)(રહે.સુધા કલશ એપાર્ટમેન્ટ ની સામે જોધપુર ગામ રોડ સેટેલાઈટ) એ તા.૧૬/૬/૧૯ ના રોજ સાબરમતી પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૦૧/૦૩/૨૦૧૭ થી તા.૩૦/૦૩/૨૦૧૯ સુધીના સમયગાળા દરમ્યાન આશ્રય-૯ તથા આશ્રય-૧૦ સ્કીમના કેવલ વિઝલ કોર્પોરેશન ના ડાયરેક્ટર/બિલ્ડર (૧) કેવલભાઈ ભંવરભાઈ પટેલ (૨) જીગીશાભેન કેવલભાઈ મહેતા અને (૩) મોહિત અશોકભાઈ બોરા (ત્રણેય રહે.આશ્રય-૯ તથા ૧૦ ન્યુ રાણીપ સાબરમતી) એ ભેગામળી સાબરમતી ન્યુ રાણીપ ખોડીયાર માતાના મંદિર પાસે આશ્રય ૯ તથા ૧૦ નામની સ્કીમ ખાતે જિજ્ઞેશભાઈએ અગલ-અલગ ફ્લેટોમાં ફ્લોરનું કામ તેમજ ઇલેક્ટ્રીકનું કામ કરેલ હોય, તે પેટે ચુકવવાના થતા કુલ રૂપિયા ૧,૩૦,૭૪,૧૧૨/- નહીં ચુકવી છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યો છે. આ ગુનાની તપાસ પો.ઇ.શ્રી આર.એચ.વાળા ચલાવે છે.

ઘરફોડ:-

સમાચાર યાદી નં.૧૦૩૩/૧૯

સેટેલાઈટ : જગદીશભાઈ ચિમનભાઈ પટેલ (ઉ.વ.૪૭)(રહે.વૃદાવન બંગ્લોઝ નુતન નાગરીક બેન્કની બાજુમા સેટેલાઈટ) એ સેટેલાઈટ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૫/૦૬/૨૦૧૯ રાતના ૧૧/૦૦ થી તા.૧૬/૦૬/૨૦૧૯ ના કલાક ૬/૩૦ સુધીના સમયગાળા દરમ્યાન પોતાના ઘરના બેઠકરૂમની બારીની ગીલ તોડી અજાણી વ્યક્તિ ઘરમા પ્રવેશ કરી કુલ રૂપિયા ૧,૯૬,૦૦૦/- ની મતા ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી જી.ડી.પરમાર ચલાવે છે.

પર્સ ઝુટવી લઈ ગયા:-

સમાચાર યાદી નં.૧૦૩૪/૧૯

**એલીસબ્રીજ :** જોસેફ હેમીલ્ટન સતવેદી (ઉ.વ.૭૭)(રહે. એબેન એજર સોસાયટી દેવાસ ફ્લેટની સામે રત્નદિપ સોસાયટીની બાજુમા જીવરાજ પાર્ક વેજલપુર) એ તા.૧૬/૬/૧૯ ના રોજ એલીસબ્રીજ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૦/૦૬/૨૦૧૯ બપોરના ૧/૦૦ થી ૧/૩૦ વાગ્યા દરમ્યાન માણેકબાગ ચાર રસ્તા થી શ્રેયસબ્રીજ ચડતા પહેલા રોડ ઉપરથી પત્ની સાથે પસાર થઇ રહ્યા હતા દરમ્યાન પત્નીના ખોળામાંથી લેડીઝ પર્સ કે જેમાં મોબાઇલ ફોન જેના કિંમત રૂપિયા ૮,૦૦૦/-, આશરે રોકડ રૂપિયા ૫૦,૦૦૦/-તથા અગત્યના દસ્તાવેજો મળી કુલ રૂપિયા ૫૮,૦૦૦/- ની મતા મુકેલ પર્સ ખેચી લઇ ચોરી કરી નાસી ગયા હતા. આ ગુનાની તપાસ હે.કો.શ્રી હિરાભાઇ મૂળજીભાઇ ચલાવે છે.

અપમૃત્યુ:-

સમાચાર યાદી નં.૧૦૩૫/૧૯

**દાણીલીમડા:** અમરત હક્ષજી સરગડા (ઉ.વ.૩૦) (રહે.સંતોષનગર બહેરામપુરા) તા.૧૫/૦૬/૧૯ બપોરના ૨/૦૦ વાગ્યાના સુમારે ગોવિંદવાડીની બાજુમા આવેલ ફેક્ટરીમા સીમેન્ટના પતરા પર ડામર લગાવતા હતા ત્યારે સીમેન્ટના પતરા ઉપરથી નીચે પડી જતા ગંભીર ઈજાઓ થતા સારવાર માટે સીવીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન રાતના ૧૧/૩૦ વાગે તેમનું મૃત્યુ નિપજયું હતું. આ અંગે દાણીલીમડા પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ મ.સ.ઈ.શ્રી સોહાબખાન અઝીઝખાન ચલાવે છે.

આત્મહત્યા:-

સમાચાર યાદી નં.૧૦૩૬/૧૯

**જીઆઇડીસી વટવા:** નૈયનાબહેન દિલિપભાઇ આંબલીયા (ઉ.વ.૩૮) (રહે. પરિમલપાર્ક સોસાયટી જસોદાનગર જીઆઇડીસી વટવા) એ સંતાન પ્રાપ્તી માટે ટેસ્ટ ટ્યુબ બેબીનો પ્રયત્ન કરેલ પરંતુ સફળતા નહી મળતા મનમાં લાગી આવતા તા.૧૨/૦૬/૧૯ કલાક ૧૨/૦૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે ઝેરી દવા પી લીધી હતી. સારવાર માટે એલ.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તા.૧૫/૦૬/૧૯ રાતના ૧૦/૦૦ વાગે તેમનું મૃત્યુ નિપજયું હતું. આ અંગે જીઆઇડીસી વટવા પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઈ.શ્રી યુ.કે.જાદવ ચલાવે છે.

**શાહપુર:** ઝાબીરહુસૈન એહમદમિયા સૈયદ (ઉ.વ.૫૪) (રહે. ડાયમંડ ફ્લેટ ટોરેન્ટ પાવર પાસે શાહપુર) એ બિમારીથી કંટાળી તા.૧૫/૦૬/૧૯ રાતના ૧૦/૩૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે શાહપુર પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઈ.શ્રી એન.કે.ડામોર ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,  
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.  
પોલીસ કમિશનર વતી.